

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૮/૦૪/૨૦૧૬ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર
શહેર પોલીસ ધ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી:- સમાચાર યાદી નં.૭૮૭/૧૬

ચોરીના ત્રણ ટુ વ્હિલર મોટરસાઈકલ તથા ચાર મોબાઈલ ફોન સાથે રીઢા વાહન ચોરને પકડી પાડી ત્રણ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી કાઈમ બ્રાન્ચ

અમદાવાદ શહેર વિસ્તારમાં મિલકત સબંધી બનતા ગુન્હાઓ શોધી કાઢવા સારુ સંયુક્ત પોલીસ કમિશનરશ્રી જે.કે.ભટ્ટ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી દિપન ભદ્રન સાહેબનાઓએ આપેલ સુચના અનુસંધાને મદદનીશ પોલીસ કમિશનર શ્રી કે.એન.પટેલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એન્ટી પ્રોપર્ટી સ્કોડ નં.-૧ ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.એન.ઝાલા તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એચ.પી.કરેણ નાઓ સાથેના સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને બાતમી હકીકત મળેલ કે “એક રાજુ શ્રીમાળી નામનો ઈસમ પોતાના કબજામાં ચોરીની મોટર સાયકલ લઈ કેનાલ રોડ ખાતેથી આવી ઈસનપુર રોડ થઈ ગોવિંદવાળી તરફ જવાનો છે જે મો.સા.નો નંબર જી.જે-૦૧-એસ.ટી-૯૬૪૧ નો લખેલ છે” જે બાતમી હકીકત આધારે ભૈરવનાથ રોડ ઉપર આવેલ રોડ એ.એમ. ટી.એસ.વર્કશોપ સર્કલ પાસેથી રાજેશભાઈ દશરથભાઈ શ્રીમાળી ઉ.વ.૧૮ રહે.સરણીયાવાસ નારોલ ગામ અમદાવાદ શહેરનાને રોકી લઈ તેના કબજાનુ મો.સા.નો નંબર જી.જે-૦૧-એસ.ટી-૯૬૪૧ તથા તેની પાસેથી એક સેમસંગ કંપનીનો મો.ફોન કબજે કરેલ છે.

આરોપીની સઘન પુછપરછ કરતા આ સિવાય બીજા બે બાઈકો ચોરી કરી જે જગ્યાએ મુકેલ તે જગ્યાએ જઈ હિરો-હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ જેનો આર.ટી.ઓ.નં- જી.જે.૦૧-પી.એફ.-૯૦૯૧ તથા હિરો-હોન્ડા કંપનીનુ પેશન પ્લસ જેનો આર.ટી.ઓ.નં- જી.જે.૧૮-આર-૬૪૫૯ જે પણ કબજે કરેલ છે અને જેમાં મો.સા. જી.જે-૦૧-એસ.ટી-૯૬૪૧ સબંધે સોલા પોસ્ટે. તથા મો.સા. નં. જી.જે.૦૧-પી.એફ.-૯૦૯૧ સબંધે કાલુપુર.વે.રેલ્વે પોલીસ સ્ટેશન તથા મો.સા. જી.જે.૧૮-આર-૬૪૫૯ જે સબંધે ગાંધીનગર સેક્ટર,૭ પોસ્ટે ખાતે ચોરીની ફરીયાદ થયેલ હોય જે ત્રણ ગુન્હા શોધાયેલ છે અને આ સિવાય આરોપીના ઘરેથી બીજા ત્રણ મોબાઈલ ફોન પણ કબજે કરેલ છે તે મોબાઈલ ફોન સબંધે આગળની વધુ તપાસ ચાલુ છે.

આરોપી અગાઉ પણ શાહીબાગ પોલીસ સ્ટેશન તથા વડનગર પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીના ગુન્હામાં પકડાયેલ છે.જે આરોપીની આગળની વધુ તપાસ પો.સ.ઈ. શ્રી એચ.પી.કરેણનાઓ ચલાવી રહેલ છે.

નરોડા પો સ્ટે

નરોડા પો સ્ટે ફસ્ટ ગુ ર નં ૪૪/૨૦૧૬ ધી ઇ પીકો કલમ ૩૭૬.૩૧૨.૪૦૬ મુજબના કામે ગઇ તા ૨૭/૪/૧૬ ના કલાક ૨૨/૧૦ વાગે ગુનો દાખલ થયેલ જેની તપાસ પો સબ ઇન્સ ડી પી સોલંકી નાઓએ કરતા અરોપી મિતેશ કુમાર દિનેશભાઈ ટાંક રહે સી/૨૪ ન્યુ સતાધારનગર વિરાટનગર ની બજુમા ઓઢવ અમદાવાદ શહેર નાને આજરોજ તા ૨૮/૪/૧૬ ના કલાક ૪/૧૫ વાગે તેના ઘરેથી મળી આવતા અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.